

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૫/૨/૨૦૧૭ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

અમદાવાદ શહેર પોલીસ તરફથી કરવામાં

આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી નં.૩૯૪/૧૭

ઓઢવ પોલીસે તા.૨૪/૨/૧૭ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે બાતમીના આધારે ઓઢવ આદીનાથનગર આરોપી સુજીત સ\ઓ સુરેશકુમાર યાદવ (ઉ.વ.૧૯) (રહે.ગોકુલનગર જડેશ્વર મંદિરની બાજુમાં આદીનાથનગર ઓઢવ) ને હિરો હોન્ડા સ્પેન્ડર મોટર સાયકલ નંબર જીજે ૧ જેપી ૭૯૩૮ કિમત રૂપિયા ૧૫,૦૦૦/- ચોરીના વાહન સાથે ઝડપી લઈ સી.આર.પી.સી.કલમ ૪૧ (૧) (ડી) મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નાસતો-ફરતો આરોપી અરવિંદ ધુળાજી ઠાકોર (રહે.લક્ષ્મીનગર ખોડીયારનગર નિકોલ) નિકોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮૪/૧૬ ઇ.પી.કો.કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૨૯૪ (ખ) ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબના કામે નાસતો ફરતો હોઈ તા.૨૪/૨/૧૭ રાતના ૮/૧૫ વાગ્યાના સુમારે નિકોલ પોલીસે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

નરોડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૪૫/૨૦૦૯ ઇ.પી.કો.કલમ ૩૭૬ કામના આરોપી મુકેશ ઉર્ફે વકીલ રતીલાલ રાહોડ (રહે.ગંગોત્રી સોસાયટી નરોડા) ઉપરોક્ત ગુનામાં સજામાં જેલ ખાતે સજા ભોગવતો હતો. જે દિન-૧૪ ની પેરોલ ફર્લો રજા લઈ રજા પુર્ણ થતા હાજર ન થતો હોઈ નાસતો ફરતો હોઈ નરોડા પોલીસે ખાનગી રાહે તપાસ કરતા તા.૨૪/૨/૧૭ નારોજ મળી આવતા સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાજર કર્યો હતો.

કાગડાપીઠ પોલીસે સોલા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૬૩/૨૦૧૫ ઇ.પી.કો.કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) ૧૧૪ મુજબના કામના વોન્ટેડ આરોપી સમીર ધીરજભાઈ મકવાણા (રહે.આર્યનગર સોસાયટી કુટબોલ ગ્રાઉન્ડ) ને બાતમીના આધારે તા.૨૪/૨/૧૭ બપોરના ૧/૪૫ વાગ્યાના સુમારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

નાયબ પોલીસ કમિશનર  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.